

સરેરાશ માસિક બેલેન્સ	
AMB (જરૂરી)	શૂન્ય
AMB બિન-જાળવણી શુલ્ક	લાગુ પડતું નથી
ટ્રેમિલી એકાઉન્ટ્સ અથવા બિઝનેસ એકાઉન્ટ્સ સાથે યુપીઆઇ	
સેવિંગ્સ એકાઉન્ટ યુપીઆઇ	એક જ પ્રકાર માટે પરિવારના એક સભ્યના ખાતાને ચુપ કાઢી શકાય છે
ચેક બુક (૨૫ લીફ્ટની PAP ચેક બુક)	દર અઢધા વર્ષમાં ૧ ચેક બુક મફત
મફત મર્યાદા પછી શુલ્ક	પ્રતિ લીફ્ટ ૨ રૂપિયા
ઉધરાણી	
સ્થાનિક ચેક ડ્રિસિયરિંગ	મફત
બેંક ખાતે અન્ય બેંકના ચેક કલેક્શનનું શુલ્ક	રૂ. ૫૦૦૦ સુધીનું શુલ્ક રૂ. ૨૫, રૂ. ૫૦૦૦ થી વધુ અને રૂ. ૧૦,૦૦૦ સુધીનું શુલ્ક રૂ. ૫૦/-, રૂ. ૧૦,૦૦૦ થી વધુ અને રૂ. ૧૦૦૦૦૦ સુધીનું શુલ્ક રૂ. ૧૦૦/-, રૂ. ૧૦૦૦૦૦ થી વધુનું શુલ્ક રૂ. ૧૫૦/-
બેંક સિવાયના સ્થાન પર અન્ય બેંકના ચેક કલેક્શનનું શુલ્ક	
RTGS/NEFT/IMPS ઇનવર્ડ	મફત
ફોરેન ઇનવર્ડ રેમિટન્સ	મફત
ચુકવણી	
શાખાએ ડિમાન્ડ ડ્રાફ્ટ અને પેઓર્ડર	દર મહિને ૨ ડીઝી સુધી મફત
મફત મર્યાદા પછી શુલ્ક	પ્રતિ ડીઝી રૂ. ૫૦
શાખા સિવાયના સ્થળોએ ડિમાન્ડ ડ્રાફ્ટ	પ્રતિ ડીઝી રૂ. ૧૦૦
PAP ચેક વડે ચુકવણી	મફત
શાખામાં RTGS અને NEFT આઉટવર્ડ (મફત ઓનલાઇન)	NEFT: રૂ. ૧૦૦૦૦/- સુધી રૂ. ૨.૨૫, રૂ. ૧૦૦૦૧ થી રૂ. ૧૦૦૦૦૦ સુધી: રૂ. ૪.૫, રૂ. ૧૦૦૦૦૦ થી રૂ. ૨૦૦૦૦૦ સુધી: રૂ. ૧૪.૫, રૂ. ૨૦૦૦૦૦ થી રૂ. ૫૦૦૦૦૦૦ સુધી: રૂ. ૨૪.૫, RTGS: રૂ. ૨૦૦૦૦૦ થી રૂ. ૫૦૦૦૦૦૦ સુધી: રૂ. ૨૦, રૂ. ૫૦૦૦૦૦૦ થી વધુ: રૂ. ૪૦.
IMPS આઉટવર્ડ (લિમિટ્ડ મર્યાદા રૂ. ૨,૦૦,૦૦૦/-)	૫૦૦૦૦૦ રૂપિયા સુધી: રૂ. ૨.૫/-, રૂ. ૫૦૦૦૦૦- રૂ. ૧ લાખ: રૂ. ૫/-, રૂ. ૧ લાખથી વધુ: રૂ. ૭.૫/-
રોક શુલ્ક	
રહેણાંક સ્થાને રોકક જમા (એટીએમ અને શાખા સહિત)	દર મહિને રૂ. ૧,૦૦,૦૦૦ સુધી મફત
મફત મર્યાદા પછી શુલ્ક	રૂ. ૫/૧૦૦૦
બિન-રહેણાંક સ્થાને રોકક જમા (એટીએમ અને શાખા સહિત)	શૂન્ય
મફત મર્યાદા પછી શુલ્ક	રૂ. ૪/૧૦૦૦
રહેણાંક સ્થાને રોકક ઉપાડ	મફત
બિન-રહેણાંક સ્થાને રોકક ઉપાડ	રૂ. ૪,૧૦૦૦
મેટ્રો સ્થાનો (અન્ય એટીએમ) પર ડેબિટ કાર્ડ વડે રોકક ઉપાડના વ્યવહાર	૩
નોન-મેટ્રો સ્થાન પર ડેબિટ કાર્ડ વડે રોકક ઉપાડના વ્યવહાર (અન્ય એટીએમ)	૫
એટીએમ ઉપાડની મફત મર્યાદાથી વધુ શુલ્ક	પ્રતિ નાણાકીય વ્યવહાર રૂ. ૨૩, બિન-નાણાકીય વ્યવહાર રૂ. ૧૨
નોન-ઇકવીટી એટીએમનો ઉપયોગ - અપૂરતા ભંડોળને કારણે રોકક ઉપાડ નક્કાર્યું	રૂ. ૧૦/- પ્રતિ વ્યવહાર
ભારતની બહાર રોકક ઉપાડ (માત્ર આંતરરાષ્ટ્રીય કાર્ડ માટે)	રૂ. ૧૧૦/- પ્રતિ વ્યવહાર
ભારતની બહાર બેલેન્સની પૂર્ણપરણ (માત્ર આંતરરાષ્ટ્રીય કાર્ડ માટે)	રૂ. ૨૫/- પ્રતિ વ્યવહાર
રૂપે / વિઝા કલાસિક ડેબિટ કાર્ડ (જારી કરવા માટેના શુલ્ક, વાર્ષિક ફી, ફરીથી જારી કરવા માટેના શુલ્ક)	
રૂપે પ્લેટિનમ ડેબિટ કાર્ડ (જારી કરવા માટેના શુલ્ક, વાર્ષિક ફી, ફરીથી જારી કરવા માટેના શુલ્ક)	રૂ. ૨૫૦
વિઝા ગોલ્ડ ડેબિટ કાર્ડ (જારી કરવા અને નવીકરણ માટેના શુલ્ક)	રૂ. ૧૯૯
વિઝા પ્લેટિનમ ડેબિટ કાર્ડ (જારી કરવા અને નવીકરણ માટેના શુલ્ક)	રૂ. ૨૫૦
વિઝા સિગ્નેચર ડેબિટ કાર્ડ	રૂ. ૫૦૦
કાર્ડ વડે વ્યવહારની સ્થિતિની પુનઃપ્રાપ્તિના શુલ્ક (ખોટા દાવાઓ માટે)	રૂ. ૨૫૦ પ્રતિ ચેક
સ્વૌપ પેમેન્ટ સિંગલ ચેક (ઓનલાઇન મફત)	રૂ. ૧૦૦ પ્રતિ ચેક
સ્વૌપ પેમેન્ટ સિરીઝ (ઓનલાઇન મફત)	રૂ. ૧૫૦ પ્રતિ ચેક
નાણાકીય કારણોસર આઉટવર્ડ ચેક રીઝર્વના શુલ્ક	રૂ. ૭૫ પ્રતિ ચેક
ટેકનિકલ કારણોસર આઉટવર્ડ ચેક રીઝર્વના શુલ્ક	શૂન્ય

શુલ્કનું સમયપત્રક - યુનિવર્સલ સેલરી એક્ઝાઉસ્ટ (૦૧ જૂન, ૨૦૨૫ થી અમલમાં)

ટેક્નિકલ કારણોસર ઇનવર્ડ ચેક રીઝર્વના શુલ્ક	૨ ચેકસુધી રૂ. ૫૦૦ થી, ત્રીજો ચેક રૂ. ૭૫૦/- થી
નાણાકીય કારણોસર ઇનવર્ડ ચેક રીઝર્વના શુલ્ક	શૂલ્ક
સ્થાયી સૂચનાઓ સેટ અપ/સુધારણા (RD/SIP/બિલ યુક્વણીઓ માટે મફત)	પ્રતિ વખત રૂ. ૨૫/-
સ્થાયી સૂચનાઓ નિષ્ક્રમતા (રીઝર્વ)	પ્રતિ રિઝર્વ રૂ. ૧૫૦/-
નાણાકીય કારણોસર ECS/NACH રીઝર્વ	પ્રતિ રિઝર્વ રૂ. ૨૦૦/-
SMS ચેતવણીઓ (કેબિટ અને ક્રેડિટ વ્યવહારો)	પ્રતિ મહિને ૧૦ મફત જખજ. ત્યારબાદ, પ્રતિ જખજ ૩૦ પૈસા
ફોરેન એક્સચેન્જ માર્ક-અપ ^૧	૩.૫%
પ્રમાણપત્ર અને રિપોર્ટ જારી કરવું	
શાખામાં બેલેન્સ પ્રમાણપત્ર (ઓનલાઇન મફત)	પ્રતિ વખત રૂ. ૨૫૦/-
પાછલા વર્ષની બેલેન્સ અને વ્યાજનું રેટેઇમેન્ટ (ઓનલાઇન મફત)	વર્ષ દીઠ ૧ મફત, ત્યારબાદ પ્રતિ રેટેઇમેન્ટ રૂ. ૩૦૦
પાસબુક જારી કરવી	મફત
ડ્રુડિકેટ પાસબુક જારી કરવી	રૂ. ૫૦/-
સહીની ચક્રસણી પ્રમાણપત્ર/ફોટો પ્રમાણિત/સરનામાની પુષ્ટિ (વિનંતી દીઠ)	પ્રતિ વખત રૂ. ૫૦/-
ડ્રુડિકેટ TDS પ્રમાણપત્ર	રૂ. ૧૦૦
ડ્રુડિકેટ એક્ઝાઉસ્ટ રેટેઇમેન્ટ પ્રિન્ટ (મફત ઓનલાઇન અથવા ઇમેઇલ પર)	રૂ. ૫૦
DD/PO પુનઃમાન્યીકરણ/રદીકરણ	રૂ. ૧૦૦
ખાતું ખોલવાના ૧૫ દિવસ પછી અને ૬ મહિના પૂર્ણ થાય તે પહેલાં ગ્રાહકની વિનંતી પર ખાતું બંધ	રૂ. ૫૦૦
ખાતું નિષ્ક્રિય રહેવા પર શુલ્ક	શૂલ્ક
એસ્ટેપ બેંકિંગ*	
ચેક પિકઅપ	પ્રતિ વખત રૂ. ૫૦/-
કેશ પિકઅપ વીટ (દર મહિને શુલ્ક)	
રૂ. ૨,૦૦,૦૦૦ સુધી	રૂ. ૩૫૦૦
૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦	રૂ. ૫૦૦૦
૫,૦૦,૦૦૦ થી ૧૦,૦૦,૦૦૦	રૂ. ૧૦૦૦૦
૧૦,૦૦,૦૦૦ થી વધુ	શાખાનો સંપર્ક કરો
અમમ ક્લેલ પર કેશ પિકઅપ (દર વખતે શુલ્ક)	
રૂ. ૨૦૦૦૦ સુધી	રૂ. ૧૫૦
૨૦૦૦૦૦ થી ૫૦૦૦૦૦	રૂ. ૩૦૦
૫૦૦૦૦૦ થી ૧૦૦૦૦૦૦	રૂ. ૫૦૦
૧૦૦૦૦૦૦ થી ૨૦૦૦૦૦૦	રૂ. ૮૦૦
૨૦૦૦૦૦૦ થી વધુ	શાખાનો સંપર્ક કરો
ગ્રાહક દ્વારા કરવામાં આવેલા તમામ વ્યવહારોનું એકત્રીકરણ જેમાં શામેલ છે:	
રોકડ/ચેક/છટત્રજ/ગભીત્રજ/ઉજદ/ઉઉ (ઓનલાઇન અને એટીએમ વડે થયેલ વ્યવહાર સિવાય)	દર મહિને ૫ વ્યવહારો સુધી મફત
મુકત મર્યાદથી વધુ શુલ્ક	વ્યાજિગત વ્યવહારની મર્યાદા ઉપરાંત પ્રતિ વ્યવહાર રૂ. ૧૫

*વિનંતી પર ફક્ત પસંદગીના સ્થળોએ ઉપલબ્ધ. લાગુ પડતા કાર વધારાના રહેશે કમ્પ-પેયેબલ એટ પાર ગમ: લાગુ પડતું નથી જમ: સેવિંગ્સ એક્ઝાઉસ્ટ ઈબ: ક્રેડિટ એક્ઝાઉસ્ટ

^૧ભારતીય ચલણમાં, આંતરરાષ્ટ્રીય સ્થાન પર અથવા ભારતમાં કાર્યરત પરંતુ વિદેશી રાષ્ટ્રમાં નોંધાયેલા વેપારીઓ સાથે ભારતીય ચલણમાં કરવામાં આવતા દરેક આંતરરાષ્ટ્રીય વ્યવહાર પર ૩.૫% ફોરેક્સ માર્ક-અપ ફી (લાગુ પડતા કાર) વસૂલવામાં આવશે. આ ઈએજમ ખાતા હેઠળ જારી કરાયેલા તમામ કેબિટ ક્રેડિટ માટે લાગુ પડે છે, સિવાય કે ઊદ્યોગિક (માસ્ટરકાર્ડ વર્લ્ડ) અને ગણુ (વિકા પ્લેટિનમ). રૂપા કરીને નોંધ લો કે બેંકની વિવેકનુક્રિયા આધારે આ સમયાંતરે બદલાઈ શકે છે.